



સુરત મહાનગર પાલિકા નેચરપાર્ક અને ઝુ વિભાગ

આર.ટી.આઈ. એક્ટ – ૨૦૦૫

પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝર

૨૦૨૧

(તા. ૧/૦૫/૨૦૨૧ ની સ્થિતિએ)

ઓફિસ :-

ડો. શ્યામાપ્રસાદ મુખરજી ઝુલોજીકલ ગાર્ડન
સરથાણા જકાત નાકા સામે
સુરત કામરેજ રોડ, સુરત – ૩૯૫૦૦૬

જાહેર માહિતી અધિકારી અને
ઝુ ગાઈડ
સુરત મહાનગરપાલિકા

કલમ – ૪ (૧) (ખ) (૧)
પોતાના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો :-

(૧.૧) જાહેર તંત્રના ઉદ્દેશ / હેતુ :-

- પ્રાણીસંગ્રહાલયમાં વન્યપ્રાણીઓનું સંરક્ષણ કરી વન્યપ્રાણી સંરક્ષણના રાષ્ટ્રીય હેતુમાં મદદગાર થવું.
- પ્રાણીસંગ્રહાલયમાં આવતા મુલાકાતીઓને વન્યપ્રાણી બાબતે વધુ ને વધુ જાણકારી થી અવગત કરાવવા તથા વન્યપ્રાણી સંરક્ષણ હેતુ તેઓને પ્રોત્સાહિત કરવા.
- પ્રાણીસંગ્રહાલયમાં આવતા મુલાકાતીઓને વન્યપ્રાણી બાબતે વૈજ્ઞાનિક અભ્યાસ માટે તક પુરી પાડી વન્યપ્રાણીઓનું વૈજ્ઞાનિક ઢબે મેનેજમેન્ટ કરવું.
- નાશ થવાના આરે આવી પહોંચેલ વન્યપ્રાણીઓનું વૈજ્ઞાનિક ઢબે સુવ્યવસ્થિત બ્રીડીંગ કરાવું.
- ઝુ ખાતે રેસ્ક્યુ થઈ આના વન્યપ્રાણીઓની સારવાર તથા જરૂરી નિભાવની વ્યવસ્થા કરવી.
- જગદીશચંદ્ર બોઝ એકવેરીયમ ખાતે ખારાપાણી, મીઠાપાણી તથા શાર્ક પુલમાં વિવિધ માછલીઓ નું વૈજ્ઞાનિક ઢબે પ્રદર્શિત કરવું
- એકવેરીયમમાં આવતા મુલાકાતીઓને જળસૃષ્ટી બાબતે વધુ ને વધુ જાણકારી થી અવગત કરાવવા તથા જળસૃષ્ટી સંરક્ષણ હેતુ તેઓને પ્રોત્સાહિત કરવા.

(૧.૨) જાહેર તંત્રના કાર્યો અને વિઝન :-


- સુરત ઝુમાં પ્રાણી-પક્ષીઓની સંખ્યા વધારી ઝુનો વિકાસ કરવો.
- નાશ થવાના આરે આવી પહોંચેલ વન્યપ્રાણીઓનું વૈજ્ઞાનિક ઢબે સુવ્યવસ્થિત બ્રીડીંગ કરવું તથા વધારાના પ્રાણીઓનું સક્ષમ સત્તાધીશની મંજૂરી મેળવી દેશના અન્ય ઝુ સાથે અરસ પરસ બદલી કરવી.
- વન્યપ્રાણી અંગે સંશોધનની તકો ઉભી કરવી.
- એકવેરીયમ ખાતે જળસૃષ્ટી અંગે વિવિધ સંશોધનની તકો ઉભી કરવી.

(૧.૩) જાહેર તંત્ર ધ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણ :-

- પ્રાણીસંગ્રહાલયના પ્રાણીઓ મુલાકાતી ઓ માટે નીતી નિયમાનુસાર પ્રદર્શિત કરવા.
- વન્યપ્રાણીઓ બાબતે અંગત રસ ધરાવતા મુલાકાતીઓ, ગ્રુપમા આવતાં વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવું.
- એકવેરીયમમાં વિવિધ માછલીઓ મુલાકાતી ઓ માટે નીતી નિયમાનુસાર પ્રદર્શિત કરવા.
- જળસૃષ્ટી બાબતે અંગત રસ ધરાવતા મુલાકાતીઓ, ગ્રુપમા આવતાં વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવું.

- (૧.૪) જાહેર તંત્રના રાજ્ય, નિયામક કચેરી, પ્રદેશ જિલ્લા, બ્લોક વગેરે સ્તરોએ સંસ્થાગત માળખાનો આલેખ :-

સુરત મહાનગર પાલિકા
ડો.શ્યામાપ્રસાદ મુખરજી ઝુલોજીકલ ગાર્ડન વિભાગ



(૧.૫) જાહેર તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટે લોકો પાસેથી અપેક્ષાઓ :-

● શુ કરવું.

- જરૂરી પાસ સાથે જ ઉદ્યાનમાં પ્રવેશ કરવો. આ પાસ ટિકિટ બારી પરથી ઠરાવેલ ફી ચુકવ્યાથી આપવામાં આવશે.
- ઉદ્યાનના કોઈપણ અધિકારી તપાસવા માંગે ત્યારે આ પાસ બતાવવો.
- ઉદ્યાનના વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ તથા મૌન જાળવવા.
- આપના આંખ, કાન ખુલ્લા રાખશો પણ મોં નહીં.
- ઉદ્યાનના વિસ્તારને ચોખ્ખો રાખવામાં સહકાર આપશો.
- કોઈપણ કટોકટીમાં ઉદ્યાનના અધિકારીઓને માહિતી આપશો અને અકસ્માત વખતે સહકાર આપશો.
- પ્રાણીઓની કુદરતી વર્તણુકને શાંતિથી જોશો.

● શું ન કરવું.

- ફુલ, ઝાડ, રોપાને તોડશો કાપશો કે નુકશાન કરશો નહિ.
- પ્રાણીઓને છોડશો કે ઉશ્કેરશો નહિ.
- પ્રાણીઓને ખવડાવશો નહીં.
- મુલાકાતીઓ માટે કરેલ આડશથી આગળ જવું નહિ.
- નકામાં કાગળો કે કચરાથી ઉદ્યાનને ગંદો કરવો નહીં.
- ઉદ્યાનના વિસ્તારમાં રેડીયો, ટેપ રેકોર્ડર વગેરેના ઉપયોગ કરવો નહીં.
- ઉદ્યાનમાં કોઈપણ જાતના શસ્ત્રો જેવા કે બંદુક, તીર કામઠું, ફટાકડા, ગોફણ, જાળ, ઝેર, પાંજરા અથવા એવા કોઈપણ પદાર્થ જેનાથી પ્રાણીઓ બેભાન થઈ શકે, મરી શકે કે નુકશાન પામે તે સાથે પ્રવેશ કરવો નહીં.
- પતંગીયાને પકડવા કે ખલેલ પાડવી નહિ.
- માહિતી આપતા પાટિયાઓને નુકશાન કરવું નહિ.
- બહારથી ખાવા માટેની વસ્તુઓ લાવવી નહિ.
- ઉપવનમાં કચરો નાંખવો નહિ.
- પાલતુ પ્રાણી સાથે લઈ ઉદ્યાનમાં પ્રવેશ કરવો નહિ.

(૧.૬) લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પદ્ધતિ :-

લોકોને વન્યપ્રાણી બાબતે વધુને વધુ વિવિધ માહિતીથી અવગત કરાવી વન્યપ્રાણી અને પર્યાવરણ બાબતે જાગૃતિ લાવવી. વન્યપ્રાણીનાં સંરક્ષણ અને કુદરતી પર્યાવરણ સંતુલન જાળવવા માટે સહયોગ મેળવવો.

પધ્ધતિ

- વન્યપ્રાણીનાં વિવિધ કાર્યક્રમો કરવા / ઉજવવા.
- વન્યપ્રાણી બાબતે જાણકારી મળે તે માટે માહિતીદર્શક લખાણ પ્રદર્શિત કરવા.
- પ્રાણીસંગ્રહાલયની માહિતીનાં ચોપાનીયા બનાવી મુલાકાતીઓને આપવા.
- વન્યપ્રાણીની વિવિધ બાબતે હરીફીઈઓ ઉજવવી. વકૃત્વ સ્પર્ધા યોજવી. ફિલ્મશો કરવા.
- વન્યપ્રાણીને શક્ય તેટલા કુદરતી વાતાવરણમાં પ્રદર્શિત કરવા.

(૧.૭) સેવા આપવાના દેખરેખ, નિયંત્રણ અને જાહેર ફરીયાદ નિવારણ માટે ઉપલબ્ધ તંત્ર.
પ્રાણી સંગ્રહાલય શાખાના સેવા આપવાના દેખરેખ નિયંત્રણ અને જાહેર ફરીયાદ નિવારણ માટે ઉપલબ્ધ તંત્રની વિગત પારા-(૧.૪) માં દર્શાવ્યા મુજબ છે.

(૧.૮) મુખ્ય કચેરી અને જુદા જુદા સ્તરોએ આવેલી અન્ય કચેરીનાં સરનામાં.

જી સુપ્રિટેન્ડેન્ટશ્રી,
ડો. શ્યામા પ્રસાદ મુખરજીજીલોજીકલ ગાર્ડન
જુના સરથાણા જકાતનાકા સામે, સુરત-કામરેજ રોડ,
સુરત. ૩૯૫૦૦૬
ફોન નંબર.૦૨૬૧-૨૫૭૫૬૧૧,૨૫૭૮૦૩૬
ફેક્સ નં. ૦૨૬૧૨૪૫૧૯૩૫-૨૪૨૨૧૧૦

ડેપ્યુટી કમિશનરશ્રી(ડી),
સુરત મહાનગરપાલિકા
મહાનગર સેવા સદન, ગોરધનદાસ ચોખાવાલા માર્ગ,
મુગલીસરા, સુરત ૩૯૫૦૦૩
ફોન નંબર.૦૨૬૧-૨૪૨૩૭૪૯
PABX ૨૨૨

મુખ્ય કચેરી :-

કમિશનરશ્રી,
સુરત મહાનગરપાલિકા
મહાનગર સેવા સદન, ગોરધનદાસ ચોખાવાલા માર્ગ,
મુગલીસરા, સુરત ૩૯૫૦૦૩
ફોન નંબર.૦૨૬૧-૨૪૨૩૭૫૧ થી ૨૪૨૩૭૫૬
પી.એ.બી.એક્સ. ૦૨૬૧-૨૪૨૨૨૮૫ થી ૨૪૨૨૨૮૭

વેબ સાઈટ : www.suratmunicipal.gov.in

www.suratmunicipal.org

ઈ મેઈલ : commissioner@suratmunicipal.org

(૧.૯) કચેરી શરૂ અને બંધ થવાનો સમય :-

મુલાકાતીઓ માટે પ્રાણીસંગ્રહાલય શાખાની કામગીરીનો સમય નીચે મુજબ છે.

- સવારે ૧૦.૦૦ કલાકથી સાંજે ૫.૦૦ કલાક સુધી.
- ઉનાળું તથા દીવાળી વેકેશન દરમ્યાન સવારે ૧૦.૦૦ કલાક થી સાંજે ૬.૦૦ કલાક સુધી.
- પ્રાણીસંગ્રહાલય સમગ્ર વર્ષ દરમ્યાન દર સોમવારના દિવસે તથા ધુળેટી, મોહરમ અને આનંદ ચૌદશના દિવસે મુલાકાતીઓ માટે બંધ રહે છે.

(૧.૧૦) મુખ્ય વહીવટી કચેરી શરૂ અને બંધ થવાનો સમય :-

- સવારે ૧૦.૩૦ કલાકથી બપોરે ૧૪.૩૦ કલાક.
- બપોરે ૧૫.૦૦ કલાકથી સાંજે ૧૮.૧૦ કલાક.

(૧.૧૧) પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓ માટે પ્રવેશ ફી તથા અન્ય ચાર્જ નીચે મુજબ નક્કી કરવામાં આવ્યા છે.

નેચરપાર્ક પ્રાણી સંગ્રહાલયના પ્રવેશની વિગતો :-

- (૧) દર સોમવારે પ્રાણી સંગ્રહાલય બંધ રહે છે.
- (૨) પ્રવેશનો સમય સવારે ૧૦-૦૦ થી સાંજે ૫-૦૦ વાગ્યા સુધી પરંતુ ઉનાળા અને દિવાળી વેકેશનમાં પ્રવેશનો સમય સવારે ૧૦-૦૦ થી ૬-૦૦ વાગ્યા સુધી.
- (૩) ધુળેટી, મહોરમ, ગણેશ વિસર્જનના દિવસે પ્રાણી સંગ્રહાલય બંધ રહે છે.
- (૪) કોઈપણ ખાનગી વાહન પ્રાણી સંગ્રહાલયમાં અંદર લાવવાની મનાઈ છે.
- (૫) પ્રાણી સંગ્રહાલય ખાતે પહોંચવા દરરોજ શહેરી બસ સુવિધા ચોકબજાર બસ સ્ટેન્ડ તથા રેલ્વે સ્ટેશન બસ સ્ટેન્ડથી મળી શકશે.

પ્રવેશ દરની માહિતી :-

(૧) ઝુ રાઉન્ડ / ઝુ ની મુલાકાત :-તા. ૧/૦૪/૧૮ થી સુધારેલ પ્રવેશ ફી ના દર

અ.નં.	વિગત	પ્રવેશ ફી રૂા.
(૧)	૧૨ વર્ષથી વધુ વયની વ્યક્તિ	૩૦/-
(૨)	બાળકો ૩ થી ૧૨ વર્ષ સુધી અને ૬૫ વય કે તેથી વધારે વયની વ્યક્તિ.	૨૦/-
(૩)	૩ વર્ષથી નીચેની વયના બાળકો	વિના મૂલ્યે
(૪)	પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવેલ શૈક્ષણિક સંસ્થા (પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળા) ના વિદ્યાર્થીઓ માટે	૧૦/
(૫)	ડબલ્યુ ડબલ્યુ એફ કે પ્રાકૃતિક મંડળ જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થા કે શાળાઓ માટે, કોલેજમાં વન્ય જીવન અથવા જંગલો ઉપર સંશોધન કરતાં વિદ્યાર્થીઓ માટે.	૦૫/-
(૬)	સુરત મહાનગર સંચાલિત તમામ પ્રાથમિક શાળા, મહિલા સંરક્ષણ કેન્દ્રો, અનાથ આશ્રમ, અપંગ અને માનસિક રીતે પછાત માટેની સંસ્થાઓ, કાચી ઉમરના ગુન્હેગારોની સંસ્થાઓ વિગેરેની વ્યક્તિઓ માટે.	વિના મૂલ્યે
(૭)	પરદેશીઓ (માર્ગદર્શક નકશા સાથે)	૧૦૦/-
(૮)	પરદેશીઓના બાળકો (૩ થી ૧૨ વર્ષની વયના, માર્ગદર્શક નકશા સાથે)	૫૦/-

(૨) બટરફલાય પાર્ક તેમજ વાઈલ્ડ લાઈફ ઈન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત:-

અ.નં.	વિગત	પ્રવેશ ફી રૂ.
(૧)	૧૨ વર્ષથી વધુ વયની વ્યક્તિ	૨૦/-
(૨)	બાળકો ૫ થી ૧૨ વર્ષ સુધી અને ૬૫ વય કે તેથી વધારે વયની વ્યક્તિ.	૧૦/-
(૩)	૩ વર્ષથી નીચેની વયના બાળકો	વિના મૂલ્યે
(૪)	પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવેલ શૈક્ષણિક સંસ્થા (પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળા) ના વિદ્યાર્થીઓ માટે	૧૦/
(૫)	ડબલ્યુ ડબલ્યુ એફ કે પ્રાકૃતિક મંડળ જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થા કે શાળાઓ માટે, કોલેજમાં વન્ય જીવન અથવા જંગલો ઉપર સંશોધન કરતાં વિદ્યાર્થીઓ માટે.	૧૦/-
(૬)	સુરત મહાનગર સંચાલિત તમામ પ્રાથમિક શાળા, મહિલા સંરક્ષણ કેન્દ્રો, અનાથ આશ્રમ, અપંગ અને માનસિક રીતે પછાત માટેની સંસ્થાઓ, કાચી ઉંમરના ગુન્હેગારોની સંસ્થાઓ વિગેરેની વ્યક્તિઓ માટે.	વિના મૂલ્યે
(૭)	પરદેશીઓ (માર્ગદર્શક નકશા સાથે)	૫૦/-
(૮)	પરદેશીઓના બાળકો (૫ થી ૧૨ વર્ષની વયના, માર્ગદર્શક નકશા સાથે)	૩૦/-

ફોટોગ્રાફી માટેના દર :-

અ.નં.	વિગત	દર રૂ.
(૧)	સાદા કેમેરા (૧ દિવસના)	૫૦/-
(૨)	ઘરગથ્થુ વિડીયો કેમેરા માટે (૧ દિવસના)	૧૫૦/-
(૩)	વ્યવસાય કેમેરા/વિડીયો (૧ દિવસના)	૫૦૦૦/-
(૪)	વિશ્વ પર્યાવરણ દિન તથા વન્ય જીવ પ્રાણી સપ્તાહ દરમ્યાન ૩ વર્ષ થી ૧૨ વર્ષ ના બાળકો	ફ્રી

પ્રાકૃતિક ઉદ્યાનમાં વન્ય જીવન અને પ્રાકૃતિક દશ્યોને ઝડપવા સક્ષમ અધિકારીની પહેલેથી મેળવેલ અનુમતિ જરૂરી છે.

(૧.૧૧) જાહેર તંત્રની ફરજો :-

- આ કચેરી બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ હેઠળ કાર્યરત હોય પેરા ૧.૨ માં જણાવ્યા ઉપરાંત બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ ની કલમ - ૬૩ ની હેઠળ કરેલ જોગવાઈ અનુસાર "ફરજિયાત ફરજો" બજાવે છે. તથા કલમ- ૬૬ ની હેઠળ કરેલ જોગવાઈ પૈકી ની કેટલીક "મરજિયાત ફરજો" પણ બજાવે છે .

(૧.૧૨) પ્રાણીસંગ્રહાલયમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલ આવક ની માહિતી:—

વર્ષ	કુલ મુલાકાતીની સંખ્યા	કુલ આવક
૨૦૧૬-૧૭	૧૦,૪૮,૫૬૪	૧,૩૬,૩૩,૦૮૦
૨૦૧૭-૧૮	૧૦,૧૨,૯૧૯	૧,૩૨,૩૬,૧૯૦
૨૦૧૮-૧૯	૯,૬૪,૫૭૧	૨,૪૭,૭૨,૭૯૦
૨૦૧૯-૨૦	૭,૩૨,૯૪૩	૨,૩૩,૭૨,૨૫૦
૨૦૨૦-૨૧	૧,૨૫,૯૧૩	૩૬,૭૫,૦૬૦

(૧.૧૨) પ્રાણીસંગ્રહાલયમાં છેલ્લા પાંચ વર્ષમાં આવેલ મુલાકાતીઓ ની વિગતવાર માહિતી:—

વર્ષ	નેચરપાર્ક ઝુ	ના મુલાકાતી		ટ્રસ્ટ	બટરફ્લાયપાર્કનામુલાકાતી		કુલ
	૧૨ વર્ષથી નાના	૧૨ વર્ષથી મોટા	નાના		મોટા		
૨૦૧૬-૧૭	૧,૪૬,૦૧૦	૮,૨૫,૮૬૮	૨૭,૪૦૦	૬,૪૫૦	૪૨,૭૯૬	૧૦,૪૮,૫૨૪	
૨૦૧૭-૧૮	૧,૩૯,૪૬૭	૮,૦૩,૬૦૦	૨૩,૮૮૦	૪,૫૨૫	૪૧,૪૪૭	૧૦,૧૨,૯૧૯	
૨૦૧૮-૧૯	૧,૫૯,૨૧૬	૭,૬૭,૪૬૨	૧૮,૯૫૩	૨,૧૬૩	૧૮,૨૮૭	૯,૬૪,૫૭૧	
૨૦૧૯-૨૦	૧,૧૦,૬૭૪	૫,૮૧,૪૩૦	૧૯,૨૨૬	૨,૬૩૦	૧૮,૯૮૩	૭,૩૨,૯૪૩	
૨૦૨૦-૨૧	૨૦,૫૭૩	૧,૦૫,૩૪૦	૦	૯૫૨	૪,૧૭૨	૫,૧૨૪	

કલમ – ૪ (૧) (ખ) (૨)

પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો :-

૧. ઈ.ચા.ઝુ સુપ્રિટેન્ડેન્ટ :-

- સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણીસંગ્રહાલયના દૈનિક વહિવટ,નિયમન, નિયંત્રણ અને નિતી વિષયક બાબતને લગતી કામગીરી
- કમિશનરશ્રી ધ્વારા અવાર નવાર સોંપવામાં આવતી અન્ય વહિવટી તેમજ આઉટડોર ફરજો.

૨. આસીસ્ટન્ટ વેટર્નરી ઓફિસર :-

- ઈ.ચા.ઝુ સુપ્રિટેન્ડેન્ટની ગેરહાજરીમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણીસંગ્રહાલય ના દૈનિક વહિવટ,નિયમન, નિયંત્રણ ને લગતી કામગીરી .
- પ્રાણી સંગ્રહાલય ખાતે રાખવામાં આવેલ પ્રાણીઓની પશુ ચિકિત્સા અને પશુપાલન ને લગતી કામગીરી.
- પ્રાણીસંગ્રહાલયમાં દૈનિક આવતા પ્રાણીઓના ખોરાકની તપાસ,પ્રાણીઓને આપવામાં આવતી સારવારની નોંધ ઉપરાંત સમયસર રૂટિન પ્રિવેન્ટીવ સારવાર કરવાની કામગીરી.
- પ્રાણીઓની ઈન્વેન્ટરી રિપોર્ટ બનાવવાની કામગીરી તથા પ્રાણીઓના સ્ટોક રજીસ્ટર નિભાવની કામગીરી.
- આર.ટી.આઈ. એક્ટ ૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ માટે જાહેર માહિતી અધિકારી તરીકેની કામગીરી.
- ઉપરી અધિકારી તરફથી મળતી સુચના / આદેશ મુજબની તમામ પ્રકારની કામગીરી.

૩. ક્યુરેટર :-

- સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણીસંગ્રહાલયના દૈનિકવહિવટી કામગીરી માં ઈ.ચા. ઝુ સુપ્રિશ્રીની મદદ.
- પ્રાણીસંગ્રહાલયમાં આવતા મુલાકાતીઓ પૈકી સ્કુલ , કોલેજ અને ગ્રુપમાં આવતા વિદ્યાર્થીઓને વન્યપ્રાણીઓ બાબતે શિક્ષણ અને સમજ આપવી.ઉપરાંત ઝુ એજ્યુકેશન ને લગતો એજ્યુકેશન પ્લાન બનાવી તેને ઝુ પ્રિમાઈસીસની અંદર તથા બહાર કાર્યાન્વીત કરવો.
- ઝુ ની વિવિધ કામગીરીઓ પૈકી કોઈપણ કામગીરીના વિષયનું ચયન કરી તેને માટે ફોર્મેટ બનાવી આવનાર મુલાકાતીઓ પાસેથી અભિપ્રાય મેળવી મળેલ અભિપ્રાયનું અર્થઘટન કરી જરૂરી તારણકાઠી ઝુ સુપ્રિશ્રીને રિપોર્ટ રજૂ કરવો.
- ઝુ સુપ્રિટેન્ડેન્ટ શ્રી તથા આસી.વેટ.ઓફિસરને કામગીરીમાં મદદ કરવી.

- વન્યજીવો અને પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ બાબતે જનજાગૃતીને લગતી કામગીરી.
- જાનવરોને રાખવામાં આવતા પાંજરાઓમાં એન્વાયરમેન્ટ એનરીચમેન્ટની કામગીરી.
- પ્રાણીઓના પાંજરાના સીવીલ અને સીવીલ રીલેટેડ રીપેરીંગ કામને લગતી કામગીરી માટે જરૂરી રીપોર્ટ તૈયાર કરવા.
- ઝુ માટે મેળવવામાં આવતા તથા અન્ય ઝુમાં મોકલવામાં આવતા જંગલી પ્રાણીઓની પરિવહનની કામગીરી.
- ઉપરી અધિકારી ઝુ સુપ્રિટેન્ડેન્ટશ્રી તથા આસી.વેટ.ઓફિસર તરફથી અવરનવર મળતી સુચના / આદેશ મુજબની તમામ પ્રકારની કામગીરી.

૪. ઝુ ગાર્ડ :-

- ઝુ ખાતે શાળાઓ કે ગ્રુપમાં આવતા મુલાકાતીઓની વિનંતી બાદ સાથે રહી ઝુની માહિતી આપવી.
- મુલાકાતી સિવાયના ફરજના સમયમાં તેઓને સોંપવામાં આવેલ વિભાગના પ્રાણી પક્ષીઓના પાંજરાની કામગીરીનું સુપરવિઝન કરવાની કામગીરી.
- બટરફ્લાય પાર્ક તથા ઈન્ટરપ્રિટેશન સેન્ટરના દૈનિક નિયંત્રણ, નિયમન, નિભાવની કામગીરી.
- ઉપરી અધિકારી તરફથી મળતી સુચના / આદેશ મુજબની તમામ પ્રકારની કામગીરી.
- નેચરપાર્ક ખાતેના એનિમલ કિપર, બેલદારોની હાજરી પુરવા ઉપરાંત તેઓના રજા કાર્ડના નિભાવની કામગીરી

૫. સિક્યુરીટી ઓફિસર :-

- નેચરપાર્ક ખાતેની સ્થાવર તથા જંગમ મિલકતનું પુરતું રક્ષણ પુરુ પાડવું.
- નેચરપાર્ક ખાતે આવતા મુલાકાતીઓ નેચરપાર્ક ની મિલકત તેમજ પ્રાણીઓને નુકશાન / (નડગત ના પહોંચાડે તે મુજબની તમામ વ્યવસ્થા કરી જરૂરી તકેદારી લેવી.
- સિક્યુરીટી એજન્સી ધ્વારા ફાળવવામાં આવતા જવનો શારીરીક શૈક્ષણિક તથા માનસીક રીતે થયેલ ઠરાવ ની શરતો અને બોલીઓ મુજબ છે કે કેમ ? ની ચકાસણી કરવી તેના ઓળખપત્ર ચકાસવા તેમજ તેમને પ્રાણીસંગ્રહાલયના સિક્યુરીટી પોઈન્ટ પર શુ કરવું શુ ન કરવું ની સમજ આપવી.
- નેચરપાર્ક સરથાણા ખાતે ફરજના સમય દરમ્યાન સિક્યુરીટી પોઈન્ટની દરરોજ રૂટીન હાજરી ચેકીંગ તેમજ ફરજના સમય બાદ હાજરીનું સરપ્રાઈઝ ચેકીંગ કરવાની કામગીરી.

૬. લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર :-

- પ્રાણી સંગ્રહાલય ખાતે રાખવામાં આવેલ પ્રાણીઓની પશુ ચિકિત્સા અને પશુપાલન ને લગતી કામગીરીમાં આસી.વેટ.ઓફિસરને મદદ કરવી.
- દરરોજ નેચરપાર્ક ખાતે રાખવામાં આવેલ પ્રાણી/પક્ષીઓની તંદુરસ્તીના નિરક્ષણ ની કામગીરી.
- સોંપવામાં આવેલ વિભાગના પાંજરાઓના નિયમન,નિયંત્રણ ઉપરાંત સાફસફાઈ તથા ડિસઈન્ફેક્શનની કામગીરીનું સુપરવિઝનની કામગીરી.
- પશુચિકિત્સા અધિકારી ધ્વારા આપવામાં આવતી સારવાર (પ્રિસ્ક્રીપ્શન) અન્વયે પ્રાણીઓને સીધીદેખરેખ હેઠળ સમયસર દવા આપવા / ખવડાવવાની /વેકશીનેશન અને ડિવર્મીંગને લગતી કામગીરી.
- શિડયુલ- ૧ તથા ૨ ના જાનવરો ધ્વારા તેમના તરછોડી દિધેલ બચ્ચાઓના હેન્ડ રિયરીંગથી ઉછેર ને લગતી કામગીરી.
- મદદનીશ પશુ ચિકિત્સા અધિકારીની ગેરહાજરીમાં તેમનો ફોનપર સંપર્ક કરી સંકલનમાં રહી જાનવરોના આરોગ્ય અને સ્વાસ્થ્ય બાબતે માહિતીની આપ-લે કરવી અને બિમાર જાનવરો માટે સુચના મુજબની સારવાર / કામગીરી કરવી.
- જાનવરોમાં બ્રિડીંગ ની કામગીરી માટે બ્રિડીંગ સિઝન દરમ્યાન બિહેવીયરલ રેકોર્ડ કીપીંગ સહિતની કામગીરી કરવી
- ઉપરી અધિકારી તરફથી મળતી સુચના / આદેશ મુજબની તમામ પ્રકારની કામગીરી.

૭. હોર્ટિકલ્ચરલ આસીસ્ટન્ટ

- પ્રાણી સંગ્રહાલય ખાતે રાખવામાં આવેલ ગાર્ડનીંગ તથા બટરફ્લાય પાર્ક ના ગાર્ડનીંગ ના ઈજારાદારના કામનું સુપરવિઝન.
- નેચરપાર્ક ખાતે વિવિધ ગાર્ડન પ્લોટની સફાઈનું નિરક્ષણ અને સુપરવિઝન કામગીરી.
- નેચરપાર્ક ખાતેના પ્રાણીઓના ખોરાક માટેના ફોડર ફાર્મના ઈજારાદારની કામગીરીનું સુપરવિઝન કરવું તથા જરૂરી માર્ગદર્શન આપવું.
- ઉપરી અધિકારી તરફથી મળતી સુચના / આદેશ મુજબની તમામ પ્રકારની કામગીરી.

૮. હેડ ક્લાર્ક:-

- નેચરપાર્ક ખાતાની બુકિંગ ઓફિસને લગતી તમામ વહિવટી તથા દરરોજના ભરણાની આવક સમયસર ઝોન ઓફિસમાં જમા કરાવવાની કામગીરી.
- આસી.માહિતી અધિકારી તરીકેની કામગીરી.
- તાબા હેઠળના બુકિંગ ઓફિસના સ્ટાફ વચ્ચે જરૂરીયાત મુજબ કામગીરીની વહેંચણી.
- ઉપરી અધિકારી તરફથી મળતી સુચના / આદેશ મુજબની તમામ પ્રકારની કામગીરી.

૯. સીનીયર કલાર્ક :-

- હિસાબી ખાતાને લગતી સઘળી કામગીરી.
- એસ્ટાબ્લીશમેન્ટ ને લગતી તમામ કામગીરી(પગારબીલ,એરિયર્સ ,કર્મચારીની સર્વિસબુક નિભાવની કામગીરી.)
- આર.ટી.આઈ. એક્ટ -૨૦૦૫ હેઠળ મળતી અરજીના લાગત મુદાઓ નો ખરડો તૈયાર કરી / માહિતી તૈયાર કરવાની કામગીરી.
- ઉપરી અધિકારી તરફથી મળતી સુચના / આદેશ મુજબની તમામ પ્રકારની કામગીરી.

૧૦. ત્રીજી શ્રેણી કલાર્ક :-

- એક ત્રીજી શ્રેણી કલાર્ક બુકિંગ ઓફિસની પ્રવેશ ટિકિટની વહેંચણીની કામગીરી.
- એક ત્રીજી શ્રેણી કલાર્ક હિસાબી ખાતાને લગતી સઘળી કામગીરી તથા વેકેશનના સમયમાં બુકિંગની કામગીરીમાં મદદ.
- ઉપરી અધિકારી તરફથી મળતી સુચના / આદેશ મુજબની તમામ પ્રકારની કામગીરી.

૧૧. પટાવાળા :-

- એક પટાવાળા વેટર્નરી હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે.
- બે પટાવાળા બુકિંગ ઓફિસ પર ફરજ બજાવે છે.
- એક પટાવાળા ચોકબજાર ખાતેની કચેરી પર ફરજ બજાવે છે.
- એક પટાવાળા નેચરપાર્ક ખાતે બુકિંગ ઓફિસ પર મદદ કરવા ઉપરાંત નેચરપાર્ક ખાતેની ટપાલ મુખ્ય ઓફિસ તથા મુખ્ય ઓફિસ ની ટપાલ નેચરપાર્ક લાવવાની કામગીરી બજાવે છે.
- ઉપરી અધિકારી તરફથી મળતી સુચના / આદેશ મુજબની તમામ પ્રકારની કામગીરી.

૧૨. ડ્રાઈવર :-

- ઈ.ચા.ઝુ સુપ્રિટેન્ડેન્ટશ્રીના વાહન હંકારવાની કામગીરી.
- ઝુમાં જરૂરિયાત મુજબ ખોરાક લાવવા તથા અન્ય કામગીરી વખતે ઝુ ખાતાની આયસર ગાડી હંકારવાની કામગીરી.
- ઉપરી અધિકારી તરફથી મળતી સુચના / આદેશ મુજબની તમામ પ્રકારની કામગીરી.

૧૩. મુકાદમ :-

- ગાર્ડન મેઈન્ટેનેન્સ ઈજારાદારની કામગીરી તથા નેચરપાર્ક પ્રિમાઈસીસમાં આવેલ ટોઈલેટ બ્લોકની સાફસફાઈના કામનું સુપરવિઝન.
- મેઈન ગેટ તથા કેન્ટીન આસપાસના વિસ્તારની સફાઈનું દૈનિક નિરિક્ષણ.
- નેચરપાર્ક ખાતે ના બેલદારો પાસે ગ્રુપ સફાઈની કામગીરીનું સુપરવિઝન.
- સોંપવામાં આવેલ વિભાગના પાંજરાઓના નિયમન,નિયંત્રણ ઉપરાંત સાફસફાઈતથા કામગીરીનું સુપરવિઝનની કામગીરી.
- નેચરપાર્ક ખાતે રાખવામાં આવેલ કન્ટેઈનર(કચરાપેટી) ની સમયસર ઉપાડવાની કામગીરીનું સુપરવિઝન.
- મેઈન ગેટ પર પ્લાસ્ટિક ચેકિંગની કામગીરીનું સુપરવિઝન.
- ઉપરી અધિકારી તરફથી મળતી સુચના / આદેશ મુજબની તમામ પ્રકારની કામગીરી.

૧૪. હેડ ઝુ કિપર :-

- નેચરપાર્ક ખાતે રાખવામાં આવેલ વિવિધ પ્રાણીઓ પક્ષીઓના પાંજરાઓ પર કામગીરી કરતા ઝુ કિપરોના કામગીરીનું સુપરવિઝન
- પાંજરામાં રાખવામાં આવેલા વન્ય પ્રાણીઓને સુખાકારી માટે વખતો વખત જરૂરીયાત મુજબની વ્યવસ્થા કરવી.
- પાંજરાઓની સાફ-સફાઈ, ડીસ ઈન્ફેક્શનની કામગીરી, પ્રાણીઓની અદલા બદલી, સ્થળાંતર વગેરે કામગીરીનું સુપરવિઝન.
- બિમાર પ્રાણીઓની સારવારમાં મદદ , પ્રાણીઓના વર્તનનો અભ્યાસ.
- ઉપરી અધિકારી તરફથી મળતી સુચના / આદેશ મુજબની તમામ પ્રકારની કામગીરી.

૧૫. ઝુ કિપર :-

- નેચરપાર્ક ખાતે રાખવામાં આવેલ વિવિધ પ્રાણીઓ પક્ષીઓના પાંજરાઓ પૈકી સોંપવામાં આવેલ વિભાગના પાંજરાઓ બેલદારની સાથે રહી દૈનિક સાફસફાઈ,ખોરાક આપવાની તથા પ્રાણીઓને મુલાકાતીઓના સમય દરમ્યાન પ્રદર્શનમાં રાખવા તથા ત્યારબાદ તેઓને શેલ્ટરમાં લેવાની કામગીરી.
- વિભાગના બિમાર પ્રાણીઓની સારવાર દરમ્યાન મદદ કરવાની કામગીરી.
- પ્રાણીઓના વર્તનના અભ્યાસની કામગીરી તથા પાંજરા આજુબાજુના વિસ્તારની સફાઈની કામગીરી.
- ઉપરી અધિકારી તરફથી મળતી સુચના / આદેશ મુજબની તમામ પ્રકારની કામગીરી.

૧૬. બેલદાર / ટ્રેઈની બેલદાર :-

- નેચરપાર્ક ખાતે રાખવામાં આવેલ વિવિધ પ્રાણીઓ પક્ષીઓના પાંજરાઓ પૈકી સોંપવામાં આવેલ વિભાગના પાંજરાઓ માં એનિમલ કીપર સાથે રહી દૈનિક સાફસફાઈ, ખોરાક આપવાની તથા પ્રાણીઓને મુલાકાતીઓના સમય દરમ્યાન પ્રદર્શનમાં રાખવા તથા ત્યારબાદ તેઓને શેલ્ટરમાં લેવાની કામગીરીમાં મદદ કરવાની કામગીરી.
- બિમાર પ્રાણીઓની સારવાર દરમ્યાન મદદ કરવાની કામગીરી.
- શ્રુપ સફાઈની કામગીરી.
- ઉપરી અધિકારી તરફથી મળતી સુચના / આદેશ મુજબની તમામ પ્રકારની કામગીરી.

કલમ - ૪ (૧) (ખ) (૩)

દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ :-

- (૩.૧) જુદા જુદા મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટે કઈ કાર્ય પદ્ધતી અનુસરવામાં આવે છે.
- આ કચેરી બી.પી.એમ.સી.એક્ટ-૧૯૪૯ હેઠળ કાર્યરત હોય
બી.પી.એમ.સી.એક્ટ-૧૯૪૯, બી.સી.એસ.આર.રૂલ્સ, વન્યપ્રાણી સંરક્ષણ ધારો-૧૯૭૨ તથા ઝુ રેકોગ્નીશન નિયમો નેશનલ ઝુ પોલીસીમાં જોગવાઈ ઓ ને અનુસરી ને નિર્ણય લેવામાં આવે છે.
- (૩.૨) અગત્યની બાબતો માટે કોઈ ખાસ નિર્ણયો લેવા માટેની દસ્તાવેજી કાર્યપદ્ધતીઓ / ઠરાવેલી કાર્ય પદ્ધતીઓ / નિયમ માપદંડો / નિયમો કયા કયા ? નિર્ણય લેવા કયા કયા સ્તરે વિચાર કરવામાં આવે છે.?
- પેરા ૩.૧ મુજબ ધ્યાનમાં લઈ નિર્ણય લેવામાં આવે છે. જે માટે જરૂરી ખાતાકીય પત્ર વ્યવહાર વિભાગીય વડા મારફતે કમિશનરશ્રીને મોકલવામાં આવે છે.
- (૩.૩) નિર્ણયને જનતા સુધી પહોંચાડવા માટે કઈ વ્યવસ્થા છે.?
- નિર્ણયોની લેખિત જાણ સંબંધિતને પત્ર ધ્વારા મોકલવાની વ્યવસ્થા છે.
- (૩.૪) નિર્ણય લેવાની પ્રક્રિયામાં જેના મંતવ્ય લેવામાં આવે છે તે અધિકારીઓ કયા કયા છે.?
- ઈ.ચા.ઝુ સુપ્રિટેન્ડેન્ટ —————> ડે.કમિશનરશ્રી(ડી) —————> કમિશનરશ્રી
- (૩.૫) નિર્ણય લેવાની પ્રક્રિયામાં અંતિમ સત્તાધિશ કોણ છે.?
- કમિશનરશ્રી

- (૩.૬) જે અગત્યની બાબતો પર જાહેર સત્તાધિશ ધ્વારા નિર્ણય લેવામાં આવે છે. તેની માહિતી અલગથી આપો.
- આ ખાતાને લાગુ પડતું નથી.

કલમ – ૪ (૧) (ખ) (૪)

પોતાના કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણો :-

- ધી બી.પી.એમ.સી. એક્ટ – ૧૯૪૯ અન્વયે ઝુ કમ પ્રાણીસંગ્રહાલયના નિયમન અને નિભાવ બાબતે આપેલ વિવિધ કલમોની જોગવાઈઓનો અમલીકરણ કરવા ઉપરાંત સેન્ટ્રલ ઝુ ઓથોરીટી, ન્યુ દિલ્હી ધ્વારા વખતોવખત સુચવવામાં આવતી માર્ગદર્શીકાનો અમલ કરવામાં આવે છે.

કલમ – ૪ (૧) (ખ) (૫)

પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ અથવા પોતાના કર્મચારીઓ ધ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સુચનાઓ નિયમસંગ્રહો અને રેકર્ડ

- ઝુ કમ પ્રાણીસંગ્રહાલય મહાનગર પાલિકા સંચાલિત હોય નીચે મુજબના નિયમો, વિનિયમો, સુચનાઓ નિયમ સંગ્રહો અને દફતરો ને અનુસરવામાં આવે છે.

(૧) બી.પી.એમ.સી. એક્ટ,
સુરત મહાનગર પાલિકા
સુરત.

(૨) વન્ય પ્રાણી સંરક્ષણ ધારો – ૧૯૭૨
વન્ય અને પર્યાવરણ મંત્રાલય
નવી દિલ્હી.

(૩) પ્રાણી સંગ્રહાલયની નીતીઓ (ઝુ પોલીસી)
સેન્ટ્રલ ઝુ ઓથોરીટી
નવી દિલ્હી.

કલમ – ૪ (૧) (ખ) (૬)

પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું

પત્રક :-

(૬.૧) ઝુ કમ પ્રાણીસંગ્રહાલય મહાનગર પાલિકા સંચાલિત હોય ખાતાને લગતા દસ્તાવેજો નીચે મુજબના અધિકારીઓના નિયંત્રણમાં છે.

અ.નં.	દસ્તાવેજની કક્ષા	દસ્તાવેજનું નામ	દસ્તાવેજ મેળવવાની કાર્યપદ્ધતી	કોના નિયંત્રણ હેઠળ/પાસે છે.
૧	---	હુકમો	જરૂરી વિગત સાથે અરજી કરી નિયત ફી ભરીને	ઈન્ચાર્જ ઝુ સુપ્રિટેન્ડેન્ટ
૨	---	પરિપત્રો/ઠરાવો	"	"
૩	---	કામની ફાઈલો	"	"

કલમ – ૪ (૧) (ખ) (૭)

તેની નીતિ ઘડતરના અથવા તેના અમલીકરણના સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના ધ્વારા રજૂઆત માટેની વિધિમાન કોઈ વ્યવસ્થાની વિગતો :-

➤ સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે.

કલમ – ૪ (૧) (ખ) (૮)

તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્ય નોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ :-

➤ પ્રાણીસંગ્રહાલય કમ ઝુ સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે. તેમ છતાં તેની સલાહ માટે બે કે તેથી વધુ વ્યક્તિના બનેલા બોર્ડ કે સમિતિ નીચે મુજબ છે.

૧. ગૃહનિર્માણ અને ઉદ્યાન સમિતિ,

સુરત મહાનગર પાલિકા

સુરત.

૨. ખડી સમિતિ,

સુરત મહાનગર પાલિકા

સુરત.

૩. મ્યુનિસિપલ બોર્ડ,

સુરત મહાનગર પાલિકા

સુરત.

કલમ – ૪ (૧) (ખ) (લ)

તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા :-

(લ.૧) બી.સી.એન.ટી. વાઈઝ અધિકારી અને કર્મચારીઓની માહિતી

www.suratmunicipal.gov.in પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે તથા અત્રેના ખાતાના કર્મચારીઓ મહેકમ દફતરે તથા પગાર રજીસ્ટરની નકલ નીચે મુજબની ખાતામાં ઉપલબ્ધ છે.

નેચરપાર્ક સરથાણા ના કર્મચારીઓની વિગત:-

અ.નં.	અધિકારી કર્મચારીનું નામ	કર્મચારી નંબર	હોદ્દો	પગાર ધોરણ
1	ડો. રાજેશ એ. પટેલ	32027	ઈ.ચા.ઝુ સુપ્રિન્ટેન્ડેન્ટ અને આસી.વેટ.ઓફિસર	53100 - 167800
2	શ્રીમતી હીનાબેન ચિરાગ પટેલ	39172	ઝુ ગાર્ડ	44900 - 142400
3	શ્રી પ્રિતેશ એન. પટેલ	40803	એલ.આઈ.	25500 - 81100
4	શ્રી તેજસ એસ. પટેલ	42819	હોર્ટી.આસી.	19900 - 63200
5	શ્રી આલજીભાઈ બી. ખાખડીયા	13843	સીની.કલાર્ક	35400 - 112400
6	શ્રી રાજેશકુમાર એ. ડોંગરડીવે	21973	ઝુ કિપર	29200 - 92300
7	શ્રી કેલાશ બી. બોરશે.	34274	ઝુ ઈન્સપે.કમ કલાર્ક	25500 - 81100
8	શ્રી ધવલ એન. ચાણક્ય	47843	ત્રી.શ્રે.કલાર્ક	19900-63200
9	શ્રી વિપુલકુમાર એ. પટેલ	89195	તાલી.ત્રી.શ્રે.કલાર્ક	10000 FIX
10	શ્રી પ્રતિક વાય.ટેલર	47754	ત્રી.શ્રે.કલાર્ક	19900-63200
11	શ્રી મહેન્દ્ર આર. વાલ્હે	40405	હેડ ઝુ કિપર	19900 - 63200
12	શ્રી સુભાષચંદ્ર વી. ચૌહાણ	11068	પટાવાળા	25500 - 81100
13	શ્રી રસુલ ઈબ્રાહીમ મીરઝા	12119	પટાવાળા	25500 - 81100
14	શ્રી ચિરાગ ડી. પટેલ	42574	પટાવાળા	15700 - 50000
15	શ્રી સૂરેશ શ્રાવણભાઈ વસાવા	13240	ઝુ કિપર	29200 - 92300
16	શ્રી સૂરેશચંદ્ર સી. પટેલ	18804	ઝુ કિપર	29200 - 92300
17	શ્રી બળવંતભાઈ એમ. પરમાર	32155	કુક	19900 - 63200
18	શ્રી સુમા મલજીભાઈ બારૈયા	35804	બેલદાર	19900 - 63200
19	શ્રી શંકર સી. રાંદેરી	36962	બેલદાર	15700 - 50000
20	શ્રી કસુ એમ. ડામોર	36964	બેલદાર	15700 - 50000
21	શ્રી મોહન કે. ચારણિયા	40489	બેલદાર	15700 - 50000
22	શ્રી અતુલ ડી. ગામીત	41157	બેલદાર	15700 - 50000
23	શ્રી મયુર પી. પટેલ	41258	બેલદાર	15700 - 50000
24	શ્રી રાકેશ એચ. ગામીત	41352	બેલદાર	15700 - 50000
25	શ્રી ગણેશ ડી. દેશમુખ	41446	બેલદાર	15700 - 50000
26	શ્રી મુકેશ એન. પરમાર	41450	બેલદાર	15700 - 50000

27	શ્રી સુનિલ કે. માળી	41455	બેલદાર	15700 - 50000
28	શ્રી જીતેષ એલ. પરમાર	41459	બેલદાર	15700 - 50000
29	શ્રી ભીખા જે.વાઘેલા	41460	બેલદાર	15700 - 50000
30	શ્રી કનુભાઈ.એન. પણદા	41611	બેલદાર	15700 - 50000
31	શ્રી દીલીપ કે.ડામોર	41967	બેલદાર	15700 - 50000
32	શ્રી વિપુલ ડી.પટેલ	41973	બેલદાર	15700 - 50000
33	શ્રી ગાયત્રીબેન જી. રાઠોડ	89914	તાલી.બેલદાર	8500 FIX
34	શ્રી હિરેન ડી.સોલંકી	45480	સફાઈ કામદાર	15700 - 50000
35	શ્રી રાહુલ કે.મકવાણા	45481	સફાઈ કામદાર	15700 - 50000
36	શ્રી મનોહર એ.દેસલે	45674	ગ્રુ કિપર	19900 - 63200
37	શ્રી પવન આર.પાટીલ	45675	ગ્રુ કિપર	19900 - 63200
38	શ્રી ચેતન એસ.પાટીલ	45676	ગ્રુ કિપર	19900 - 63200
39	શ્રી મૃત્યુંજય આર.મહીરે	45677	ગ્રુ કિપર	19900 - 63200
40	શ્રી ગિરીશકુમાર જે.ચૌધરી	45678	ગ્રુ કિપર	19900 - 63200
41	શ્રી જયેશ એમ.મહાજન	45679	ગ્રુ કિપર	19900 - 63200
42	શ્રી આકાશ વી.પરમાર	45680	ગ્રુ કિપર	19900 - 63200
43	શ્રી વિનોદભાઈ આર.પટેલ	70248	તાલી.બેલદાર	9500 FIX
44	શ્રી. સુનીલ આઈ. સોલંકી	46308	કલીનર	15700-50000
45	શ્રી શૈલેષ એમ.સુરતી	48247	ડ્રાઈવર	19900-63200
46	શ્રી વિજયા કે. જેઠવા	40402	સફાઈ કામદાર	15700 - 50000
47	શ્રી મોહમદ હુસેન જી. ચોહાણ	73046	તાલી.બેલદાર	8500 FIX
48	શ્રી ડ્રીકલકુમાર એચ. પટેલ	72980	તાલી.બેલદાર	8500 FIX
49	શ્રી અજયકુમાર રતિલાલ પટેલ	73781	તાલી.બેલદાર	7500FIX
50	શ્રી હિરેનકુમાર મહેશભાઈ પટેલ	73789	તાલી.બેલદાર	7500FIX

કલમ – ૪ (૧) (ખ) (૧૦)

તેના વિનિમયોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પધ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓને મળતા માસિક મહેનતાણા :-

- બી.સી.એન.ટી. વાઈઝ અધિકારી અને કર્મચારીઓની માહિતી www.suratmunicipal.gov.in પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે તથા અત્રેના ખાતાના કર્મચારીઓ મહેકમ દફતરે તથા પગાર રજીસ્ટરની નકલ ખાતામાં ઉપલબ્ધ છે.(પેરા નં. ૯.૧ મુજબ)

કલમ – ૪ (૧) (ખ) (૧૧)

તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને ચુકવેલા નાણા પરના અહેવાલોની વિગતો દર્શાવતી, તેની દરેક એજન્સીનું ફાળવેલ અંદાજપત્ર :-

(૧૧.૧) મહાનગર પાલિકા સંચાલિત પ્રાણીસંગ્રહાલય કમ ઝુ ના વર્ષ ૨૦૨૦-૨૧ નું અંદાજ પત્ર નીચે મુજબ છે.

➤ એકત્રિત રેવન્યુ આવક :-

(રૂ. લાખમાં)

અ.નં	બજેટ સેન્ટર હેડ પ્રોજેક્ટ હેડ એકાઉન્ટ હેડ	એકાઉન્ટ કોડ	મંજૂર થયેલ રકમ ૨૦૨૦-૨૦૨૧	છેલ્લા વર્ષની થયેલ આવક ૨૦૨૦-૨૧
૧	પ્રાણીસંગ્રહાલયની આવક	૧૧૨૨	૨૨૫.૦૦	૩૬.૭૫
૨	ટેન્ડર ફોર્મનું વેચાણ	૧૭૫૪	૦.૨૦	૦.૧૨
૩	ઈજારાદારોને દંડ	૧૮૦૭	૦.૫૦	૦.૨૩
૪	લાઈસન્સ પરવાના ફી (જી.એસ.ટી લાગુ)	૧૨૬૧	૫૬.૦૦	૨.૫૪
૫	અન્ય પરચુરણ આવક	૧૮૦૯	૨.૫૦	૪.૮૪
બજેટ સેન્ટર ટોટલ			૨૮૪.૨૦	૪૪.૪૮

➤ એકત્રિત રેવન્યુ ખર્ચ (પ્રાણીસંગ્રહાલય) :-

(રૂ. લાખમાં)

અ.નં	બજેટ સેન્ટર હેડ પ્રોજેક્ટ હેડ એકાઉન્ટ હેડ	એકાઉન્ટ કોડ	મંજૂર થયેલ રકમ ૨૦૨૦-૨૧	છેલ્લા વર્ષનું થયેલ ખર્ચ ૨૦૨૦-૨૧
૧	વાહન ભાડુ ખર્ચ	૨૩૦૨	૧.૫૦	૦.૧૮
૨	તાર-ટપાલ ખર્ચ	૨૩૩૧	૦.૦૫	૦.૦૨
૩	છપામણી	૨૩૫૧	૦.૨૫	૦.૦૦
૪	કોમ્પ્યુટર સ્ટેશનરી	૨૩૫૨	૦.૨૫	૦.૦૩
૫	અન્ય સ્ટેશનરી	૨૩૫૩	૨.૦૦	૦.૧૪
૬	ફ્લોપી ડિસ્ક અને ટેપ	૨૩૫૪	૦.૦૦	૦.૦૦
૭	સ્થાનિક મુસાફરી ખર્ચ	૨૩૭૧	૨.૦૦	૦.૦૨
૮	રહેવા તથા જમવાનો ખર્ચ	૨૩૭૩	૨.૦૦	૦.૧૭
૯	સલાહકાર ફી/ ખર્ચ	૨૪૪૩	૧૦.૦૦	૦.૦
૧૦	સરભરા ખર્ચ	૨૪૮૧	૦.૫૦	૦.૦
૧૧	પુસ્તકો, સામાયિકો, અને વર્તમાનપત્રોનું લવાજમ	૨૪૮૩	૦.૧૫	૦.૦
૧૨	પ્રસંગો ઉત્સવ ઉજવણી ખર્ચ	૨૪૮૫	૧.૦૦	૦.૦
૧૩	વાહન બળતણ ખર્ચ	૨૪૯૦	૧.૦૦	૧.૧૯
૧૪	વપરાશી માલસામાન (સ્ટેશનરી અને છપામણી સિવાય)	૨૪૯૨	૦.૫૦	૦.૦૧
૧૫	અન્ય પરચુરણ ખર્ચ	૨૪૯૯	૩.૫૦	૦.૫૫
૧૬	મરામત-મકાનો	૩૦૦૨	૧.૦૦	૦.૦૦
૧૭	મરામત-જાહેર સ્થળો	૩૦૦૩	૩૦.૦૦	૧૩.૯૦
૧૮	મરામત-વાહનો અને માર્ગ વાહનવ્યવહારના સાધનો	૩૦૦૮	૦.૨૫	૦.૧૧
૧૯	મરામત-ઓફિસ સાધનો	૩૦૦૯	૦.૫૦	૦.૩૭
૨૦	નિભાવ - ઢોરઢાંખર	૩૦૧૧	૭૫.૦૦	૬૦.૬૩
૨૧	કાર્યક્રમને લગતા-કોન્ટ્રાક્ટ	૩૫૧૫	૦૧.૦૦	૦.૦૦
	બજેટ સેન્ટર ટોટલ		૧૩૨.૪૫	૭૭.૭૫

- કેપિટલ ખર્ચ (પ્રાણીસંગ્રહાલય) :-
- પ્રાણીસંગ્રહાલય સ્થાયી મિલકત ખરીદી(C-011)

(રૂ. લાખમાં)

અ.નં	બજેટ સેન્ટર હેડ પ્રોજેક્ટ હેડ એકાઉન્ટ હેડ	એકાઉન્ટ કોડ (C-011)	વર્ષ ૨૦૨૦-૨૧ નું મંજૂર થયેલ	છેલ્લા વર્ષનું થયેલ ખર્ચ ૨૦૨૦-૨૧
૧	ચાલુ કામ-યાંત્રિક વાહનો	૫૭૫૯	૧૦.૦૦	૫.૩૮
૨	ચાલુ કામ-ફર્નિચર	૫૭૭૧	૧.૦૦	૦.૦૦
	પ્રોજેક્ટ ટોટલ		૧૧.૦૦	૫.૩૮
●	પશુ-પક્ષીઓ/સરિસૃપો ની ખરીદી	(C-441)		
૧	ચાલુકામ પ્રાણીસંગ્રહાલય	૫૬૪૫	૨૦.૦૦	૦.૦૦
	પ્રોજેક્ટ ટોટલ		૨૦.૦૦	૦.૦૦
●	પ્રાણીસંગ્રહાલય સિવિલકામ	(C-442)		
૧	ચાલુકામ પ્રાણીસંગ્રહાલય	૫૬૪૫	૨૦૦.૦૦	૦૦.૦૦
	પ્રોજેક્ટ ટોટલ		૨૦૦.૦૦	૦૦.૦૦
	બજેટ સેન્ટર ટોટલ		૨૩૧.૦૦	૫.૩૮

કલમ - ૪ (૧) (ખ) (૧૨)

ફાળવેલ રકમો સહિત સબસીડી કાર્યક્રમોની અમલબજવણીની રીત અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો :

- સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે અત્રેના ખાતાની અલાયદી માહિતી નથી.

કલમ - ૪ (૧) (ખ) (૧૩)

તેને આપેલ છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવવનારાની વિગતો :-

- સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે અત્રેના ખાતાની અલાયદી છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ આપવામાં આવતી નથી.

કલમ - ૪ (૧) (ખ) (૧૪)

ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેની પાસેની માહિતીને લગતી વિગતો :-

- સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે અત્રેના ખાતાની જરૂરિયાત મુજબની માહિતી વિજાણુ રૂપે ઉપલબ્ધ રાખવામાં આવે છે.

કલમ - ૪ (૧) (ખ) (૧૫)

જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તો તેવા ગ્રંથાલય અથવા તેના વાચનકક્ષના કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો :-

- સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે. તેમ છતાં જાહેર ઉપયોગ માટે વિવિધ ઝોનમાં જાહેર વાંચનાલય મહાનગર પાલિકા ધ્વારા નિર્માણ કરવામાં આવેલ છે. જે પૈકી મુખ્ય ગ્રંથાલયોની માહિતી નીચે મુજબ છે.

➤ કવિનર્મદ મધ્યસ્થ પુસ્તકાલય
આઈવા લાઈન્સ, સુરત
ફોન નં. ૦૨૬૧-૨૬૬૫૮૭૩

➤ સાક્ષર ડો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિવિધલક્ષી વાંચનાલય
અડાજણ, સુરત
ફોન નં. ૦૨૬૧-૨૬૬૫૮૭૩

પુસ્તકાલયનો સમય:- સવારે ૮-૦૦ કલાક થી રાત્રે ૮-૦૦ કલાક સુધી

પુસ્તક આપ-લે સમય:- સવારે ૮-૩૦ કલાક થી રાત્રે ૭-૩૦ કલાક સુધી (સોમવાર સિવાય)

જાહેર રજાના દિવસોમાં સવારે ૮-૦૦ કલાક થી રાત્રે ૨-૦૦ કલાક સુધી

કલમ - ૪ (૧) (ખ) (૧૬)

જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદ્દા અને બીજી વિગતો :-

➤ (૧૬.૧) પ્રાણીસંગ્રહાલય ના જાહેર માહિતી અધિકારી

અ.નં .	નામ	હોદ્દો	કચેરી ફોન નં.	મોબાઈલ નંબર	ફેક્સ નંબર	સરનામું
૧	શ્રીમતી હિનાબેન સી. પટેલ	ઝુ ગાર્ડ	(૦૨૬૧) ૨૪૨૩૭૫૧થી ૨૪૨૩૭૫૬ ૨૭૯૯૪૫-૪૬	૯૮૨૫૯ ૦૫૩૦૯	(૦૨૬૧) ૨૪૫૧૯૩૫, ૨૪૨૨૧૧૦	ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ઝુલોજીકલ ગાર્ડન, જુના સરથાણા જકાતનાકાની સામે, વરાછા રોડ, સુરત.

➤ (૧૬.૨) પ્રાણીસંગ્રહાલય ના એપેલેટ અધિકારી

અ.નં .	નામ	હોદ્દો	કચેરી ફોન નં.	મોબાઈલ નંબર	ફેક્સ નંબર	સરનામું
૧	ડો.રાજેશ એ. પટેલ	ઈ.ચા.ઝુ સુપ્રિટેન્ડેન્ટ	(૦૨૬૧) ૨૪૨૩૭૫૧થી ૨૪૨૩૭૫૬ ૨૭૯૯૪૫-૪૬	૯૮૨૫૩ ૩૪૨૪૫	(૦૨૬૧) ૨૪૫૧૯૩૫, ૨૪૨૨૧૧૦	ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ઝુલોજીકલ ગાર્ડન, જુના સરથાણા જકાતનાકાની સામે, વરાછા રોડ, સુરત.

કલમ – ૪ (૧) (ખ) (૧૭)

ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી :-

- (૧૭.૧)લોકો ધ્વારા પુછવામાં આવતા પ્રશ્નોના જવાબો : –ટેલીફોનીક,રૂબરૂ તથા લેખિતમાં આપવામાં આવે છે.
- (૧૭.૨)માહિતી મેળવવા અંગે : –માહિતી (મેળવવાનો)અધિકાર અધિનિયમ-૨૦૦૫ અને ગુજરાત માહિતી અધિકાર નિયમો-૨૦૦૫ ની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવાથી માહિતમિળી શકે છે.
- (૧૭.૩)જાહેરતંત્ર ધ્વારા લોકોને આ બાબતે તાલિમ આપવા બાબત: – હાલમાં આ કચેરી ધ્વારા આવી કોઈ તાલિમ આપવામાં આવતી નથી.
- (૧૭.૪)નિયમ સંગ્રહ-૧૩માં સમાવિષ્ટ ન કરાયેલ હોય તેવાં જાહેરતંત્રએ આપવાનાં "ના વાંધા" પ્રમાણપત્રો અંગે : – આ કચેરી ધ્વારા આવા કોઈ પ્રમાણપત્ર આપવામાં આવતાં નથી.
- (૧૭.૫)નોંધણી પ્રક્રિયા અંગે: – આ કચેરી ધ્વારા આવીકોઈ નોંધણીની કામગીરી કરવામાં આવતી નથી.
- (૧૭.૬)જાહેર તંત્રએ કર ઉઘરાવવા અંગે.: – આ કચેરી ધ્વારા આવીકોઈ કર ઉઘરાવવાની કામગીરી કરવામાં આવતી નથી.
- (૧૭.૭)વિજળી,પાણી,ના કાયમી તથા હંગામી જોડાણો આપવા અંગે :- આ કચેરી ધ્વારા આવી વિજળી,પાણી,ના કાયમી તથા હંગામી જોડાણો આપવાની કામગીરી કરવામાં આવતી નથી.
- (૧૭.૮)જાહેરતંત્ર ધ્વારા પુરી પાડવામાં આવનાર અન્ય સેવાઓની વિગત: – આ કચેરી ધ્વારા અગાઉ પેરા નં.(૧.૩) માં જણાવ્યા સિવાયની અન્ય વિશેષ સેવા આપવામાં આવતી નથી.

જાહેર માહિતી અધિકારી અને ઝુ ગાઈડ
સરથાણા નેચરપાર્ક અને પક્ષીઘર
સુરત મહાનગર પાલિકા